

Indian Bank
Shop No. B-3 to 8, Ground Floor, Soham Complex,
Nr. Soti Ni Chali Char Rasta, Odhav, Ahmedabad-382415
Ph: 079-22892120, Email: bapunagar@indianbank.co.in

[Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002]
Possession Notice (for Immoveable property)

Whereas, The undersigned being the Authorised officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under section 13(12) (read with Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 19.05.2022 calling upon the borrower **M/s Sarina Enterprise (Proprietorship Firm, Borrower), Mr. Muniruddin G. Shaikh (Proprietor & Guarantor), Mrs. Sarina M. Shaikh (Guarantor) and Mr. Gulam Mayuddin Kutbuddin Shaikh (Guarantor & Mortgagor)** to repay the amount mentioned in the notice being **Rs. 32,06,466.50 (Rupees Thirty Two Lakh Six Thousand Four Hundred Sixty Six and Fifty Paise only)** as on 19.05.2022 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the borrowers/guarantors/mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said rules on **4th day of November of the year Two Thousand Twenty Two.**

The borrowers/Guarantors/Mortgagor in particular and the public in general are hereby cautioned not to deal with this property and any dealings with the property will be subject to the charge of **Indian Bank, Bapunagar Branch** for an **Rs. 32,06,466.50 (Rupees Thirty Two Lakh Six Thousand Four Hundred Sixty Six and Fifty Paise only)** as on 19.05.2022 and future interest & expenses thereon. The borrowers attention is invited to the provision of subsection 8 of Section 13 of the Act in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY
All that piece and parcel of immovable property being Flat No. A/16 on 4th floor in Block No.-A of "SUNRISE APARTMENT" maintained by Sunrise Co-operative Housing Society Limited admeasuring 76.92 sq. mtrs. i.e 92 Square Yards (Super Built Up) lying on Survey No. 14 Hissa No. 14/3 Mouje Gam Maktampur, Taluka and District of Ahmedabad (Paldi-4), within the state of Gujarat, standing in the name of **Mr. Shaikh Gulam Mayuddin Kutbuddin**. The boundaries of the **Property** are: North : Flat No. A/15, South : Block No. B, East : Society Road, West : Passage

Date : 04.11.2022
Place : Ahmedabad

Chief Manager & Authorized Officer
For Indian Bank

HDFC BANK
Registered Office: HDFC Bank House,
Senapati Bapat Marg, Lower Panel (West),
Mumbai - 400 013 and having one of its office as
Retail Portfolio Management at HDFC Bank Ltd, 1st Floor, I-Think Techno Campus,
Kanjurmarg (East), Mumbai - 400042.

SALE INTIMATION AND PUBLIC NOTICE FOR SALE OF SECURITIES PLEDGED TO HDFC BANK LTD.

The below mentioned Borrowers of HDFC Bank Ltd. (the "Bank") are hereby notified regarding the sale of securities pledged to the Bank, for availing credit facilities in the nature of Loan/Overdraft Against Securities.

Due to persistent default by the Borrowers in making repayment of the outstanding dues as per agreed loan terms, the below loan accounts are in delinquent status. The Bank has issued multiple notices to these Borrowers, including the final sale notice on the below-mentioned date whereby, Bank had invoked the pledge and provided 7 days' time to the Borrower to repay the entire outstanding dues in the below accounts, failing which, Bank would be at liberty to sell the pledged securities without issuing further notice in this regard.

The Borrowers have neglected and failed to make due repayments, therefore, Bank in exercise of its rights under the loan agreement as a pledgee has decided to sell / dispose off the Securities on or after 14th November, 2022 for recovering the dues owed by the Borrowers to the Bank. The Borrowers are, also, notified that, if at any time, the value of the pledged securities falls further due to volatility in the stock market to create further deficiency in the margin requirement then Bank shall at its discretion sell the pledged security within one (1) calendar day, without any further notice in this regard. The Borrower(s) shall remain liable to the Bank for repayment of any remaining outstanding amount, post adjustment of the proceeds from sale of pledged securities.

Sr. No.	Loan Account Number	Borrower's Name	Outstanding Amount as on 3 rd Nov., 2022	Date of Sale Notice
1	XXXX5008	NILAY RAMESHCHANDR MEHTA	6,037.00	11-Oct-22
2	XXXX0437	BAKUL KANTILAL SHAH	452,553.95	18-Oct-22
3	XXXX1927	URMILABEN M PATEL	1,300,816.16	11-Oct-22
4	XXXX9370	KALPESH HASMUKHBHAI CHAUHAN	21,449.84	18-Oct-22
5	XXXX2810	KRUPA MAYANKKUMAR GAJERA	1,026,254.80	18-Oct-22
6	XXXX8374	ASHISH JOSHI	1,097,805.41	18-Oct-22
7	XXXX1981	SURESHKUMAR GOPALDAS LALWANI	1,978,875.76	18-Oct-22
8	XXXX0415	KOMAL H DAVE	549,899.00	11-Oct-22
9	XXXX8621	PARSHVA GAUTAM NAGARSHETH	765,356.82	18-Oct-22
10	XXXX2673	AMRISHKUMAR PRAVINBHAI PATEL	275,179.44	18-Oct-22
11	XXXX9403	VIJAYKUMAR MAGANILAL VASHI	21,337.96	18-Oct-22

Date : 07.11.2022
Place : Gujarat

Sd/-
HDFC BANK LTD.

BANK OF MAHARASHTRA
Zonal Office Ahmedabad
2nd Floor, Mavalankar Haveli, Vasant Chowk, Bhadra,
Ahmedabad: 380001, Phone: (079)25507901/03
E-mail : dzmahmedabad@mahabank.co.in,
legal_ah@mahabank.co.in

POSSESSION NOTICE
(For Immoveable Property)

AX/5/Rajdeep Maninagar/2022-23 Date: 03.11.2022
To, By Registered – AD

1 (a) Rajdeep Enterprise (Partnership Firm)
19 Veddhumi Industrial Park,
Nr. Keshabnagar Industrial Estate,
Gatrad Road Bakrol, Ahmedabad-382430

1 (b) Rajdeep Enterprise (Partnership Firm)
W/201, Madhuvan Glory, Bh Dhamidhar Bungalows, Krishnagar, Nava Naroda Ahmedabad-382350

2 (a) Rajdeep Enterprise (Partnership Firm)
B-28 Ashapura Apartment, Near Anil Starch Mill, Near Vikas Estate, Bapunagar Ahmedabad 380024

2 (b) Mr. Sanjay Chidival (Partner & Guarantor, Mortgagor of Rajdeep Enterprise)
W/201, Madhuvan Glory, Bh Dhamidhar Bungalows, Krishnagar, Nava Naroda Ahmedabad-382350

3 (a) Mr. Ramesh Laljibhai Parmar (Partner, Guarantor and Mortgagor of Rajdeep Enterprise)
B-28 Ashapura Apartment, Near Anil Starch Mill, Near Vikas Estate, Bapunagar, Ahmedabad 380 024

3 (b) Mr. Ramesh Laljibhai Parmar (Partner, Guarantor and Mortgagor of Rajdeep Enterprise)
208, Shivshakti Nagar, Nikol Naroda Road, Akash Park, Odhav, Ahmedabad

WHEREAS, The undersigned being the Authorised Officer of the Bank of Maharashtra under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and in exercise of the powers conferred under Sub-Section (12) of Section 13 read with Rule 8 of the Security Interest (Enforcement) Rule, 2002, issued a Demand Notice dated- 25.08.2022 calling upon the borrower, **Rajdeep Enterprise (Partnership Firm)** through its partner **Mr. Sanjay Chidival and Mr. Ramesh Laljibhai Parmar** to repay in full the amount of **Rs. 3,36,37,868/-** plus interest thereon all facilities @ 11.10 % p.a w.e.f. 24.08.2022 within 60 days from the date of receipt of the said Notice.

The notice was sent by Regd Ad Post calling upon the borrower and guarantors for payment of dues towards to the bank. The borrower having failed to repay the amount, Notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said Act read with Rule 8 of the said rules on this 03.11.2022.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Bank of Maharashtra for an amount **hereinabove** mentioned.

The details of the properties mortgaged to the Bank and taken possession by the Bank are as follows:

PROPERTY NO. 1
Name of Owner: **Mr. Ramesh Laljibhai Parmar**
That the immovable property NO. 1 Tenament No. 34 its Admeasuring 334.45 sq mtrs and construction stand thereon 61.04 sq. mtrs in Nigam Co. operative Housing Society Ltd. Situated and lying on freehold non agricultural land bearing Block/survey no.823/2 Paiki, T.P.S. No. 88 of Mouje Vatva Taluka dascroi ,Dist. Ahmedabad.

Bounded by as follows:
On or towards North - Tenament No. 33, On or towards South - Tenament No. 1, 2, 3
On or towards East - Tenament No. 9, On or towards West - Common Road to Society

Together with all the fixtures and furnitures.

PROPERTY NO. 2
Name of Owner: **Shri. Ramesh Laljibhai Parmar**
That the immovable property NO. 2 Plot/Shed no. 19 its Admeasuring 176.38 sq. mtrs Land together with undivided proposed net Land Admeasuring 88.54 sq. mtrs, total p.k Admeasuring 264.92 sq. mtrs and construction thereon 176.423sq. mtrs. In scheme name as "Ved Bhoomi Industrial Estate" Survey no. 316P, 317, 318 OLD SURVEY NO. 406, 405) at village Bakrol-Bujrang, Taluka Dasroli, Sub District Ahmedabad-12 (Nikol), 382433.

Bounded by as follows:
On or towards North - Plot no. 18, On or towards South - Plot no. 20, 21
On or towards East - Road as per plan, On or towards West - Plot No. 24

FOR, BANK OF MAHARASHTRA
(Subodh Eknath Shelar)
Chief Manager / Authorised Officer under SARFAESI Act, 2002
Ahmedabad Zone

Vijay Commercial Co. Operative Bank Ltd.
"Vijay Bhavan", Kanak Road, Rajkot.

Appendix IV m(SEE RULE 8(1) POSSESSION NOTICE

WHEREAS, The undersigned being the Authorized Officer of The Vijay Commercial Co. Opp. Bank Ltd., Rajkot under the "Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 [54 of 2002]] and in exercise of powers conferred under Sec.13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rule, 2002 issued demand notice on the date as mentioned below calling upon the borrower to repay the amount mentioned in the said notice within 60 days from the date of receipt of the said notice as per the details given in below table :

Name of The Borrower / Co-Borrower / Mortgagor / guarantor / Loan A/c No.	13(2) Notice Date and Amount	Description of Mortgaged Property	Date of Possession taken
Loan A/C. No.001025602000033 M/S. Sagar Impex (Borrower), Rakeshbhai Navaldas Dasani & Shilpaben Rakeshbhai Dasani (Partner) Madhusudan Chunilal Katharinar (Guarantor)	13(2) Dt. 15/07/2022 Rs. 1,27,91,326=00 Rs. One Crore Twenty Seven Lakh Ninety One Thousand Three Hundred Twenty Six Only.	Immovable Property Situated In Dist. Sub Dist. Rajkot, Survey No. 374 Paiki, City Survey Ward No. 7, Sheet No. 323, City Survey No. 4056 Paiki, Plot No. 3, Sub Plot No. 3/C Land Area Adm. 73-47 Sq. Mtrs., owned by Shilpaben Rakeshbhai Dasani and Its bounded as per under North : Road Situated, South : Others Property Situated East : Others Property Situated, West : Road Situated (Symbolic Possession)	04-11-2022

The Borrower having failed to repay the amount, therefore notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein above mentioned table in exercise of powers conferred on him / her under Sec.13(4) of the said Act, 2002 read with Rule 8 of the said rule on the date mentioned in the above table. The Borrower's attention is invited to provision of Sub Sec. (8) of the said Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealing with the property will be subject to the charge of the Vijay Commercial Co. Opp. Bank Ltd. Rajkot for the amount and interest thereon mentioned in the above table.

Date :- 07-11-2022, Place:- Rajkot

Sign, Authorized Officer -
Vijay Commercial Co. Operative Bank Ltd. - Rajkot

India Shelter
REGD. OFFICE:- Plot-15, 6th Floor, Sec-44, Institutional Area, Gurugram, Haryana-122002
BRANCH OFFICE : Unit No.305-306, Raindrops, 3rd Floor, Opposite CG Center, C.G Road, Ahmedabad 380006, Gujarat & Permal prime, 3rd floor, 15A Sardarnagar, Sarveshwar Chowk, Dr Yagnik Road, Rajkot 360001

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

Whereas, The Undersigned Being The Authorised Officer Of The India Shelter Finance And Corporation Ltd. Under The Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement (security) Interest Act, 2002 And In Exercise Of Power Conferred Under Section 13(12) Read With Rule 3 Of The Security Interest (enforcement) Rules, 2002, Issued A Demand Notice On The Date Noted Against The Account As Mentioned Hereinafter, Calling Upon The Borrower And Also The Owner Of The Property/surety To Repay The Amount Within 60 Days From The Date Of The Said Notice. Whereas The Owner Of The Property And The Other Having Failed To Repay The Amount, Notice Is Hereby Given To The Under Noted Borrowers And The Public In General That The Undersigned Has Taken Symbolic Possession Of The Property/ies Described Herein Below In Exercise Of The Powers Conferred On Him/her Under Section 13(4) Of The Said Act Read With Rules 8 & 9 Of The Said Rules On The Dates Mentioned Against Each Account. Now, The Borrower In Particular And The Public In General Is Herby Cautioned Not To Deal With The Property/ies And Any Dealing With The Property/ies Will Be Subject To The Charge Of India Shelter Finance Corporation Ltd For An Amount Mentioned As Below And Interest Thereon, Costs, Etc.

NAME OF THE BORROWER/GUARANTOR (OWNER OF THE PROPERTY) & LOAN ACCOUNT NUMBER	DESCRIPTION OF THE CHARGED /MORTGAGED PROPERTY (ALL THE PART & PARCEL OF THE PROPERTY CONSISTING OF)	DT. OF DEMAND NOTICE, AMOUNT DUE AS ON DATE OF DEMAND NOTICE	DATE OF POSSESSION
MRS. CHETNABEN KIRANKUMAR PATEL W/O KIRANKUMAR PATEL RESIDE AT: 2163 KISHOR GALLYA N/ KHADKI KOT NI RANGASTODIYA DARGAJA, AHMEDABAD, GUJARAT-380001 LOAN ACCOUNT NO. LAP200005752	All Piece And Parcel Property Bearing Property Municipal Census No.2163/1, Municipal Tenament No.0104-65-0276-0001-r/municipal, Tenament No.0104-65-0276-0002-p, Admeasuring Abt 39-29-81 Sq. Mtrs. Plot With Usable Area 31.68 mtrs. Ground Floor On The First Floor In Khadki, From Gallya Ni Pole Situated At Mouje Khadia 2 Taluka City Dist Ahmedabad Gujarat 380001 Bounded As: East : Common Chowk west : Common Wall Towards Dhal Ni Pole north : House Of Arvindhai Khalias, South : House Of Dhwanikdash Patel	Demand Notice 17.08.2022 Rs. 508905.74/- (rupees Five Lakh Fifty Eight Thousands Two Hundred Five And Seventy Four Paise Only) Due As On 10.08.2022 Together With Interest. From 11.08.2022 And Other Charges And Cost Till The Date Of The Payment.	04.11.2022 (SYMBOLIC POSSESSION)
MRS. AREFABANU SHAIKH W/O MOHAMMAD SHAFIQUE SHAIKH RESIDES AT : CHANGES POLE 7/3, 3RD FLOOR, 01 SURVEY NO. 194243, J.P SCHOOL, DARIYAPUR, AHMEDABAD GUJARAT-380001. LOAN ACCOUNT NO. LAS38CLLNS00005027206 & LAP600006980	All That Pieces And Parcel Of Property Bearing Flat No. 1, 3rd Floor, In Kumbhar Apartment Situated On Land Bearing City Survey No.1942 & 1943 Mouje Dariyapur Ward-1 Taluka City In The Registration Sub District Of Ahmedabad Gujarat-380001.	Demand Notice 27.04.2022 Rs. 812259.22/- (rupees Eight Lakh Twelve Thousands Two Hundred Fifty Nine And Twenty Two Paise Only) Due As On 30.04.2022 Together With Interest. From 01.05.2022 And Other Charges And Cost Till The Date Of The Payment.	02.11.2022 (SYMBOLIC POSSESSION)
MRS. ALKABEN BAGTHARIYA W/O HARSUBHAI BAGTHARIYA RESIDES AT : 08 NR. RANUJA GUJARAT HOUSING BOARD, TEMPLE PARTH VIDHYALAYA KOTIARIYA RAJKOT GUJARAT-360002 LOAN ACC NO. HL35CHLON00005027113 & HL35CHLON00005004684	All Pieces And Parcel Property Bearing A Residential House Unit No.35 Admeasuring Area 35-01 Sq. Mtrs. Of 206 Sit & Service Of Gujarat Housing Board Of Revenue Survey No.352 Paikes Village Kotariya Ta Dist Rajkot In The State Of Gujarat Bounded As : North : Unit No.34, South : Unit No.36, East : Road, West unit No.42	Demand Notice 17.08.2022 Rs. 1911202.72/- (rupees Ten Lakh Eleven Thousands Two Hundred Two And Seventy Two Paise Only) Due As On 10.08.2022 Together With Interest. From 01.05.2022 And Other Charges And Cost Till The Date Of The Payment.	04.11.2022 (SYMBOLIC POSSESSION)

PLACE: Gujarat DATE: 07.11.2022 FOR INDIA SHELTER FINANCE CORPORATION LTD. (AUTHORISED OFFICER)

FOR ANY QUERY PLEASE CONTACT Mr. KISHAN CHAUHAN (+91 6003065830) & MR. ASHISH BHATT (+91 7874110808)

Centrum
Corporate & Registered Office : Unit No. 801, Centrum House, CST Road, Vidyannagri Marg, Kalina Santacruz (East), Mumbai - 400098, CIN No. U65922MH2016PLC273826

POSSESSION NOTICE
(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of **Centrum Housing Finance Ltd** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002. Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Co-borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Centrum Housing Finance Ltd for an amount as mentioned herein under with interest thereon.

The Borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s)/ Branch Account No./Branch	Description of secured assets (immovable property)	Date of Demand Notice & Total Outstanding Dues (Rs.)	Possession Taken Date
1	Rekhaben Pravinbhai Vanra/Pareshbhai Pravinbhai Vanra / AMDAM18002014/ Ahmedabad	F/302, 3rd Floor, Diviya Residency Nr. Mannohan Park Virat nagar Road, Nikol, Ahmedabad-382350, Gujarat. Boundaries: East : Marguin then Society Compound, West : Marguin then Flat No. F/303, North : Flat No. F/301, South : Block No. G	17-08-2022 Rs. 29,27,750 -/- (Rupees Twenty Nine Lakh Twenty Seven Thousand Seven Hundred Fifty Only)	03-11-2022
2	Gopalbhai Jugtubhai Marvadi/ Kamladevi Saluram/ AMDAM18001467 & AMDAM18001661/ Ahmedabad	Tenament No. 20, Admeasuring 68 Sq. Mts., Bhagyashri Residency, Near S M Patel High School, situated on land of Final Plot No. 43 of Town Planning Scheme No. 1 (land of old Revenue Survey No. -77/2), Mouje & Taluka- Bavla, Ahmedabad-382220. Sanand, Gujarat. Boundaries- East : Tenament No. 21, West : Tenament No. 19, North : Society Road, South : Other Survey No.	17-08-2022 Rs. 19,66,564 -/- (Rupees Six Lac Nine Thousand Three Hundred Seventy Seven Only)	05-11-2022

Place : Gujarat
Date : 07.11.2022

Sd/-
Authorised Officer
For Centrum Housing Finance Ltd

AARTI SURFACTANTS LTD
Regd. Off.: Plot Nos 801, 801/23, Phase-III, G.I.D.C. Estate, Vapi-396195, Dist. Valsad, Gujarat
Corp. Off.: Unit 202, Plot 71 Udyog Kshetra, 2nd Floor, Mulund-Goregaon Link Road, Mulund (W), Mumbai- 400 080
Website: www.aarti-surfactants.com; Email: info@aarti-surfactants.com; CIN: L24100GJ2018PLC102891

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2022												
(₹ in lakhs)												
Sr. No	Particulars	Standalone					Consolidated					
		Quarter Ended		Half Yearly Ended		Year Ended	Quarter Ended		Half Year Ended		Year Ended	
		30-Sep-22	30-Jun-22	30-Sep-21	30-Sep-22	30-Sep-21	31-Mar-22	30-Sep-22	30-Jun-22	30-Sep-21	30-Sep-22	31-Mar-22
1	Total Income from Operations (Net)	15,176.52	15,813.33	13,981.52	30,989.85	28,896.53	57,551.70	15,176.52	15,813.33	13,981.52	30,989.85	28,896.53
2	Net Profit /(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	106.19	512.77	128.36	618.96	699.00	932.46	106.20	512.69	128.32	618.89	698.86
3	Net Profit /(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	106.19	512.77	128.36	618.96	699.00	932.46	106.20	512.69	128.32	618.89	698.86
4	Net Profit /(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	32.31	370.86	83.39	403.17	535.25	550.05	32.32	370.78	83.35	403.10	535.11
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	32.31	370.86	83.39	403.17	535.25	554.85	32.32	370.78	83.35	403.10	554.28
6	Paid-up Equity Share Capital (Face Value of ₹ 10/- each)	758.45	758.45	758.45	758.45	758.45	758.45	758.45	758.45	758.45	758.45	758.45
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-	-	12,835.07	-	-	-	-	12,833.32
8	Net Worth	-	-	-	-	-	13,593.52	-	-	-	-	13,591.77
9	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)	1. Basic/Diluted:	0.43	4.89	1.10	5.32	7.06	7.25	0.43	4.89	1.10	5.31
												7.24

Note:
1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of Stock Exchange(s) viz. www.bseindia.com and www.nseindia.com and website of the Company i.e. www.aarti-surfactants.com
2) Figures for the previous period have been regrouped or rearranged wherever necessary.
3) The above financial Results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 05, 2022.

Place: Mumbai
Date : 05.11.2022

For AARTI SURFACTANTS LIMITED
Sd/-
Nikhil P DESAI
MANAGING DIRECTOR

AU SMALL FINANCE BANK LIMITED
A SCHEDULED COMMERCIAL BANK
Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381)

Demand Notice Under Section 13(2) of Securitisation Act of 2002

As the loan account became NPA therefore the Authorized officer under section 13(2) of "The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002" had issued 60 days demand notice to the Borrowers/Co-borrowers/Mortgagors/Guarantors (collectively referred as "Borrowers") as given in the table. According to the notice if the borrowers do not deposit the entire amount within 60 days, the amount will be recovered from auction of the mortgage properties/secured assets as given below. Therefore you the borrowers are informed to deposit the entire loan amount along with future interest and expenses within 60 days from the date of demand notice, otherwise under the provisions of 13(4) and 14 of the said Act, the Authorized officer is free to take possession for sale of the mortgage properties/secured assets as given below. Borrowers to note that after receipt of this notice, in terms of Section 13(13) of the Act, 2002, you are prohibited and restrained from transferring any of the secured assets by way of sale, lease or otherwise, without prior written consent of the secured creditor. Borrowers attention are attracted towards Section 13(8) r/w Rule 3(5) of The Security Interest (Enforcement) Rules, 2002 Act that the borrowers shall be entitled to redeem their secured asset upon the payment of the complete outstanding dues as mentioned below before the publication of auction notice, which thereafter shall cease to exist.

Name of the Borrower/ Co-Borrower / Mortgagor / Guarantor / Loan A/c No.	Date and Amount of Demand Notice Under Sec. 13(2)	Description of Mortgaged Property
(Loan A/C No.) L9001060121569711, Punjab Prant Patidar Trading Co Through Its Partner Sandip Detroja Smt. Devikaben Sandipbhai Detroja (Co-Borrower), Sandip Kantilal Detroja (Co-Borrower) Rajnikant Kantilal Detroja (Co-Borrower)	15-Oct-22 ₹ 34,58,467/- Ths. Thirty-Four Lac Fifty-Eight Thousand Four Hundred Sixty-Seven Only as on 15-Oct-22	Property Situated At Shop No. 2, Ground Floor, Near Lakh No. 108, Rudresh Plaza, Behind Old Bus Stand, Dist - Morbi, Gujarat Admeasuring 363.68 Sq.Ft.
(Loan A/C No.) L9001060117933751, Ravi Rameshbhai Vaghela (Co-Borrower & Legal Heir Of Late Shri Rameshbhai Prabhubhai Vaghela - Borrower) Parth Rameshbhai Vaghela (Co-Borrower) ,	18-Oct-22 ₹ 22,80,207/- Rs. Twenty-Two Lac Eighty Thousand Two Hundred Seven Only as on 17-Oct-22	Property Situated At Ward No. 02, C.S. No. 892, 893, 894, 895, Ground Floor, First & Second Floor, Shop No. 07, Vill. - Wadhwan, Dist.- Surendra Nagar, Gujarat Admeasuring 73.75 Sq. Mtr.
(Loan A/C No.) L9001120100792345, Amarnath Imitation Jewellery Through IT'S Proprietor Parashbhai Rathod Paras A Rathod (Co-Borrower), Anilbhai Kavabhai Rathod (Co-Borrower) Raj Anilbhai Rathod (Co-Borrower) Smt. Dharti Parashbhai Rathod (Co-Borrower), Smt. Laxmiben Anilbhai Rathod (Co-Borrower)	20-Oct-22 ₹ 1,97,96,400/- Rs. One Crore Ninety-Seven Lac Ninety-Six Thousand Four Hundred Only as on 20-Oct-22	(Property 1) Property Situated At Revenue Survey No. 189 Paiki, C.S. Ward No. 12/2, C.S. No. 5099/B-53 Paiki, T.P. No. 7, Fp No. 11,12,13, Paiki, Silver Nest P Plot No. 53 To 64 P, Sub Plot No. 53 To 64/16, Dist.- Rajkot Gujarat, Admeasuring 93.50 Sq. Mtr. (Property 2) Property Situated At Sub Plot No. 37 To 48/14 To 17/3, Rajkot Revenue Survey No. 189 Paiki, Silver Nest Implementation Of Tp No. 7, Fp No. 11,12,13 P Of City Survey Ward No. 12/2, City Survey No. 5099 P, Dist.- Rajkot Gujarat Admeasuring Constructed On Total Land Admeasuring 162.76 Sq. Mtr.

Date : 05/11/2022 Place : Gujarat Authorised Officer AU Small Finance Bank Limited

MUTHOOT HOUSING FINANCE COMPANY LIMITED
Registered Office: TC NO.14/2074-7, Muthoot Centre, Punnem Road, Thiruvananthapuram - 695 034, CIN NO - U65922KL2010PLC025624, Corporate Office: 12/A 01, 13th floor, Parinee Crescendo, Plot No. C38 & C39, Bandra Kurla Complex-G block (East), Mumbai-400051 TEL.



સ્ટેટ્સ એસોસિએટેડ મેનેજમેન્ટ બ્રાન્ચ ૨, કલકત્તા
“ગુવર્નદીપ બિલ્ડિંગ”, પહેલી માળ, મિલકતન સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૧૧
ફોન:૦૩૩-૨૨૮૮૦૧૬/૦૨૦૦, ફેક્સ: ૦૩૩-૨૨૮૮૦૨૩૩, ઇમેઇલ: sbi.18192@sbi.co.in

ઇ-હરાજુ નોટીસ

અધિકૃત અધિકારીની વિગતો: નામ: સૌરભકુમાર શર્મા, ઇમેઇલ: sharmasaurav@sbi.co.in, ફોન : ૦૩૩ ૪૦૦૧ ૯૯૬૦

(જુઓ નિયમ ૮(૬) અને ૯ (૧) ની જોગવાઈઓ)

સ્થાવર મિલકતોના વેચાણ માટેની વેચાણ નોટીસ

સિક્કોસીટી ઇન્વેસ્ટર (એન્ગેલોસ્ટ્રી) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૬ થી નિયમ ૮(૬) અને ૯ (૧) ની જોગવાઈઓ સાથે સંબંધિત સિક્કોસીટીટાઇપોગ્રાફ અને સેક્યુરિટીઝન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ગેલોસ્ટ્રી ઓફ સિક્કોસીટી ઇન્વેસ્ટર એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજુ નોટીસ

ઇ-હરાજુની તારીખ અને સમય: તારીખ: ૨૮.૧૧.૨૦૨૨

સમય : સવારે ૧૧.૦૦ વાગ્યાથી ૩.૦૦ વાગ્યા સુધી રજા બિનિટ બીડ દીઠ ૫ મિનીટના અમઘાંદિત વધાસ સહીત

બિ-બીડ ઇએમકીની ચુકવણીની છેલ્લી તારીખ: ઇચ્છુક બીડસએ ઇ-હરાજુ પુર્ણ થાય તે પહેલાં એમએસડીસીમાં પ્રીબીડ ઇએમકી જમા કરવાની રહેશે. પ્રીબીડ ઇએમકીની કેડીટ એમએસડીસીના બેંક એકાઉન્ટમાં ચુકવણીની રસીદ મળ્યા પછી આપવામાં આવશે અને ઇ-હરાજુ વેબસાઇટમાં આવી માહિતીની જાણકારી આપવામાં આવશે બેંકિંગ પ્રક્રિયા મુજબ આમાં થોડોક સમય લાગશે અને આથી નીચેનો તેમના પોતના હિત માટે છેલ્લી મિનિટની સમયથાને ટાળવા માટે અગાઉથી પ્રીબીડ ઇએમકી રકમ જમા કરવા સલાહ છે.

આથી ખાસ કરીને દેવાદાર (રે) અને જમીનદાર (રે) અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકત સિક્કોસીટી કેડીટરને ગીરો/ચાર્જ કરાવેલ છે. જેનો પ્રત્યક્ષ કબજે નામતીચ રેસ્ટ બેંક, સિક્કોસીટી લેણદારના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે તેનું દેવાદાર મેસેજ સિદ્ધાંત કે પી કોટન ઇન્વેસ્ટીંગ પ્રાઇવેટ લીમીટેડ જે તેની રજીસ્ટર્ડ ઓફીસ, પી.ઓ. ગાડુ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત: ૩૮૩૨૫૫, કોર્પોરેટ ઓફીસ ફી-૩૦૩, કીસી બ્લોક, ત્રીજી માળ, સીટી સેન્ટર, સોલ્ટ લેક, કલકત્તા-૭૦૦૦૬૪ ખાતે ધરાવે છે અને જમીનદાર (૧) શ્રી સંકરપ્રસાદ દુધવેવાળા, સીઇઓ અને એમડી, સરનામું: એડી-૬/એ, સોલ્ટ લેક સીટી, ટેક નં. ૩, સેક્ટર-૧, બિંધાનનગર, કલકત્તા-૭૦૦૦૬૪. (૨) શ્રીમતી મંજરી દુધવેવાળા, ડાયરેક્ટર, સરનામું: બ્લોક- એડી-૬/એ, સોલ્ટ લેક સીટી, ટેક નં. ૩, સેક્ટર-૧, બિંધાનનગર, કલકત્તા-૭૦૦૦૬૪. (૩) શ્રી અનાડી દુધવેવાળા, ડાયરેક્ટર, સરનામું: બ્લોક- એડી-૬/એ, સોલ્ટ લેક સીટી, ટેક નં. ૩, સેક્ટર-૧, બિંધાનનગર, કલકત્તા-૭૦૦૦૬૪. (૪) મેસેસ અનાડી સહયોગ મિલ પ્રાઇવેટ લીમીટેડ, ફી-૩૦૩, કીસી બ્લોક, ૩જી માળ, સીટી સેન્ટર, સોલ્ટ લેક, કલકત્તા-૭૦૦૦૬૪ પાસેથી સિક્કોસીટી કેડીટરના બાંકી લેણા રૂ. ૧૧,૨૮,૪૬,૩૪૯.૩૨/- (રૂપિયા અગિયાર કરોડ અઢ્યાવીસ લાખ છેતાલીસ હજાર અસો ઓગણપચાસ અને બત્રીસ પૈસા પુરા) અને ૨૮-૦૬-૨૦૧૧ થી વ્યાજની વસૂલાત માટે ૨૮.૧૧.૨૦૨૨ ના રોજ જણાવે છે, જેણે, જેમ છે ના ધોરણે વેચવામાં આવશે. મિલકતના નિવિસ્થાની તારીખ અને સમય: ૨૩.૧૧.૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યાથી ૩.૦૦ વાગ્યા સુધી.

સ્થાવર મિલકતોની ટુંકી વિગતો જાણમાં રહેલ બોજાઓ સહીત, જો કોઇ લેણ તો

	ચિત્રાંશ કિંમત	અનરેસ્ટ મની કિયોગીટ (ઇએમકી)
૧) સ્થાવર મિલકત : લિસ્ટિંગ કે પી કોટન ઇન્વેસ્ટીંગ પ્રાઇવેટ લીમીટેડના નામે રહેલ મોજે-૧ ખેડબ્રહ્મા, પી.ઓ. શ્યામનગર, જિલ્લો: સાબરકાંઠા, ગુજરાત, કીડ નં. ૧૩૦૭, ૧૩૦૮ અને ૧૩૦૯, સર્વે નં. ૬૬/૭૩, ૬૬/૭૪ અને ૬૬/૭૬, શ્યામનગર રેલવે કોલોનિયલ ઓફિસ બનીમ અને બિલ્ડિંગ એડિયા ૨૪૮૯૦ સી.એ. <td>રૂ.૪,૦૩,૨૦,૦૦૦.૦૦</td> <td>રૂ.૪,૦૩,૨૦,૦૦૦.૦૦</td>	રૂ.૪,૦૩,૨૦,૦૦૦.૦૦	રૂ.૪,૦૩,૨૦,૦૦૦.૦૦
	બિડ બુલિંટી રકમ : રૂ. ૫૦,૦૦૦.૦૦	

વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે મહેરબાની કરીને ભારતીય રેસ્ટ બેંક સિક્કોસીટી લેણદારની વેબસાઇટ www.sbi.co.in અને મેસેસ એમએસડીસી લીમીટેડની લિંક : <https://mstcecommerce.com/auctionhome/bapi.jsp> જેવા વિનંતી છે.

તારીખ : ૦૭.૧૧.૨૦૨૨
સ્થળ : કલકત્તા

અધિકૃત અધિકારી
રેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા



Balmer Lawrie & Co Ltd.
(A Government of India Enterprise)
SBU-Industrial Packaging, 5, J N Heredia Marg, Ballard Estate, Mumbai – 400 001.
Regd. Office: 21, N S Road, Kolkata-700 001. CIN: L15492WB1924GO1004835

NOTICE INVITING TENDER (NIT)
Online / Offline offer is invited from Land Owners / Lease Hold Right Owners, for a tranche of 1.5 to 2.00 Acres of non-agricultural industrial land, for setting up a FOOD PROCESSING, PACKAGING AND TEMPERATURE CONTROLLED WAREHOUSE, located in and around NH19, NH6 & NH16 (Dankuni, Dulahagar and nearby areas), at a maximum distance of 35 KM from Kolkata GPO, West Bengal.
NIT No. BL/CC/MUM/22-23/53 dated 04/11/2022 due on 28/11/2022.
Any amendment / corrigendum, as and when required, will be uploaded only on the website of the Company www.balmerlawrie.com and interested bidders should regularly visit this website for any update.

Contact Person: Amlan Gupta; Tel No. 022 66258188 / +91 9987499905; email: gupta.amlan@balmerlawrie.com

LORDS CHLORO ALKALI LIMITED					
(CIN: L24117RJ1979PLC002099)					
Regd Office: SP-460, Matsya Industrial Area, Alwar-301030 (Rajasthan)					
Corp. Off: A-281 1 st Floor, Defence Colony, New Delhi-110024					
Phone: 011-40239034/35, Web: www.lordschloro.com					
E-mail: secretarial@lordschloro.com					
NOTICE					
Notice is hereby given that the equity share certificate for the under mentioned securities of the company have been lost/misplaced and the holder of the said securities have applied to the company to issue duplicate certificate.					
Folio No.	Certificate no.	Distinctive No.	No. of Shares	Name of the Shareholder	
60694	22844	1594551-1594600	50	V Mohan Raj	
3050	1164	695981-696030	50	Bhupesh Kumar Vinod Chandra Shah & Chandresh Kumar Vinod Chandra Shah	
3027	1151	695633-695672	40	Vinod Chandra Ramanlal Shah & Chandresh Kumar Vinod Chandra Shah	
105663	46323	2364008-2364107	100	Rajiv Singla	
67995	25082	1633466-1633515	50		
63884	23625	1609384-1609448	15	Santosh Jain & Vikash Jain	
107228	47464	2485467-2485516	50	Mahesh Chaudhary	
107505	46350	2364445-2364494	10	Prabhat Kumar Verma & Pushpa Verma	
100371	42642	2185652-2185661	10	Suneta Sharma	
Any person having objection to the same may apply to the company within 15 days of this notice otherwise, the company shall proceed to issue duplicate share certificate.					
By Order of the Board of Directors For Lords Chloro Alkali Limited					
Sd/- Nitesh Anand					
Place : New Delhi Date : 05.11.2022					
Company Secretary & Compliance Officer					

6cmx 9cm

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES, NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY, OUTSIDE INDIA.

INITIAL PUBLIC OFFERING OF EQUITY SHARES ON THE MAIN BOARD OF THE STOCK EXCHANGES IN COMPLIANCE WITH CHAPTER II OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED.

PUBLIC ANNOUNCEMENT



(Please scan this QR Code to view the Draft Red Herring Prospectus)

SBFC

SBFC FINANCE LIMITED

Our Company was originally incorporated on January 25, 2008 at Mumbai, India as "MAPE Finserve Private Limited", a private limited company under the Companies Act, 1956, pursuant to a certificate of incorporation issued by the Registrar of Companies, Maharashtra at Mumbai ("RoC"). The Board of our Company approved the change in the name of our Company from "MAPE Finserve Private Limited" to "Small Business Fincored India Private Limited" by their resolution dated July 3, 2017, which was thereafter approved by the Shareholders of our Company through their resolution dated August 24, 2017 and a fresh certificate of incorporation, under the Companies Act, 2013, was issued by the RoC on August 31, 2017. Thereafter, the Board of our Company approved the change in the name of our Company from "Small Business Fincored India Private Limited" to "SBFC Finance Private Limited" by their resolution dated October 24, 2019, for the ease of reference that a shorter name provides, which was thereafter approved by the Shareholders of our Company through their special resolution dated December 11, 2019 and a fresh certificate of incorporation, under the Companies Act, 2013, was issued by the RoC on January 13, 2020. Subsequently, our Company was converted into a public limited company under the Companies Act, 2013 and consequently the name of our Company was changed from "SBFC Finance Private Limited" to "SBFC Finance Limited" pursuant to a resolution passed by the Board of our Company on September 21, 2022 and a special resolution passed by the Shareholders of our Company on September 23, 2022, and a fresh certificate of incorporation dated September 30, 2022 was issued by the RoC. For details of the change in the name and the registered office of our Company, see "History and Certain Corporate Matters" on page 231 of the Draft Red Herring Prospectus dated November 5, 2022 ("DRHP"), filed with the Securities and Exchange Board of India ("SEBI") on November 5, 2022.

Corporate Identity Number: U67190MH2008PLC178270

Registered and Corporate Office: 103, 1st Floor, C&B Square, Sangam Complex, Andheri Kurla Road, Village Chakala, Andheri (East), Mumbai 400 059, Maharashtra, India
Contact Person: Jagu Mistry, Company Secretary and Compliance Officer, Tel: +91 22 6797 5344; E-mail: complianceofficer@sbfc.com; Website: www.sbfc.com

THE PROMOTERS: SBFC HOLDINGS PTE. LTD., CLERMONT FINANCIAL PTE. LTD., ARPWOOD PARTNERS INVESTMENT ADVISORS LLP, ARPWOOD CAPITAL PRIVATE LIMITED AND EIGHT45 SERVICES LLP

INITIAL PUBLIC OFFERING OF UP TO [x] EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH ("EQUITY SHARES") OF SBFC FINANCE LIMITED ("COMPANY" OR "THE ISSUER") FOR CASH AT A PRICE OF UP TO ₹ [x] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF UP TO ₹ [x] PER EQUITY SHARE) (THE "OFFER PRICE") AGGREGATING UP TO [x] ₹ 16,000 MILLION ("OFFER") COMPRISING A FRESH ISSUE OF UP TO [x] EQUITY SHARES AGGREGATING UP TO ₹ 7,500 MILLION (THE "FRESH ISSUE") AND AN OFFER FOR SALE OF UP TO [x] EQUITY SHARES BY SBFC HOLDINGS PTE. LTD., ARPWOOD PARTNERS INVESTMENT ADVISORS LLP, ARPWOOD CAPITAL PRIVATE LIMITED AND EIGHT45 SERVICES LLP ("PROMOTER SELLING SHAREHOLDERS") (AGGREGATING UP TO ₹ 8,500 MILLION ("OFFERED SHARES")) ("OFFER FOR SALE"). AND TOGETHER WITH THE FRESH ISSUE, THE "OFFER", THE OFFER INCLUDES A RESERVATION OF UP TO [x] EQUITY SHARES, AGGREGATING UP TO ₹ [x] MILLION, FOR SUBSCRIPTION BY ELIGIBLE EMPLOYEES NOT EXCEEDING 5% OF OUR POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL (THE "EMPLOYEE RESERVATION PORTION"). THE OFFER LESS THE EMPLOYEE RESERVATION PORTION IS HEREINAFTER REFERRED TO AS THE "NET OFFER". THE OFFER AND THE NET OFFER SHALL CONSTITUTE [x]% AND [x]%, RESPECTIVELY, OF THE FULLY DILUTED POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY, OUR COMPANY, AT THE DISCRETION OF THE COMPANY AND THE PROMOTER SELLING SHAREHOLDERS, MAY CONSIDER ISSUING EQUITY SHARES ON A PRIVATE PLACEMENT BASIS FOR CASH CONSIDERATION AGGREGATING UP TO ₹ 1,500 MILLION, PRIOR TO FILING OF THE RED HERRING PROSPECTUS WITH THE ROC (THE "PRE-IPO PLACEMENT"). THE PRICE OF THE EQUITY SHARES ALL OTTED PURSUANT TO THE PRE-IPO PLACEMENT SHALL BE DETERMINED BY OUR COMPANY AND THE PROMOTER SELLING SHAREHOLDERS IN CONSULTATION WITH THE BOOK RUNNING LEAD MANAGERS. IF THE PRE-IPO PLACEMENT IS COMPLETED, THE AMOUNT RAISED PURSUANT TO THE PRE-IPO PLACEMENT WILL BE REDUCED FROM THE FRESH ISSUE, SUBJECT TO COMPLIANCE WITH RULE 19(2)(b) OF THE SECURITIES CONTRACTS (REGULATION) RULES, 1957, AS AMENDED (THE "SCRR").

THE PRICE BAND, THE MINIMUM BID LOT AND THE EMPLOYEE DISCOUNT (IF ANY) SHALL BE DECIDED BY THE COMPANY AND THE PROMOTER SELLING SHAREHOLDERS IN CONSULTATION WITH THE BRLMS AND WILL BE ADVERTISED IN ALL EDITIONS OF [x], AN ENGLISH DAILY NEWSPAPER, ALL EDITIONS OF [x], A HINDI NATIONAL DAILY NEWSPAPER, AND IN ALL EDITIONS OF [x], A MARATHI DAILY NEWSPAPER, EACH WITH WIDE CIRCULATION (MARATHI BEING THE REGIONAL LANGUAGE OF MAHARASHTRA WHERE OUR REGISTERED OFFICE IS LOCATED) AT LEAST TWO WORKING DAYS PRIOR TO THE BID/OFFER OPENING DATE AND SHALL BE MADE AVAILABLE TO THE BSE LIMITED ("BSE") AND THE NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED ("NSE"), AND TOGETHER WITH BSE, THE "STOCK EXCHANGES") FOR THE PURPOSE OF UPLOADING ON THEIR RESPECTIVE WEBSITES IN ACCORDANCE WITH THE SEBI ICDR REGULATIONS.

In case of any revision in the Price Band, the Bid/Offer Period will be extended by at least three additional Working Days after revision of the Price Band, subject to the Bid/Offer Period not exceeding 10 Working Days. In cases of force majeure, strike or similar circumstances, our Company may, for reasons to be recorded in writing, extend the Bid/Offer Period for a minimum of three Working Days, subject to the Bid/Offer Period not exceeding 10 Working Days. Any revision in the Price Band and the revised Bid/Offer Period, if applicable, shall be widely disseminated by notification to the Stock Exchanges, by issuing a press release, and also by indicating the change on the respective websites of the BRLMs and at the terminals of the members of the Syndicate and by an intimation to Designated Intermediaries and the Sponsor Bank, as applicable.

The Offer is being made in terms of Rule 19(2)(b) of the Securities Contracts (Regulation) Rules, 1957, as amended, ("SCRR") read with Regulation 31 of the SEBI ICDR Regulations. The Offer is being made through the Book Building Process, in compliance with Regulation 31 of the SEBI ICDR Regulations, where not more than 50% of the Net Offer is being made available for allocation on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") ("QIB Category"), of which our Company and the Promoter Selling Shareholders, in consultation with the Book Running Lead Managers, allocated 60% of the QIB Category to Anchor Investors, on a discretionary basis ("Anchor Investor Portion"), of which one-third will be reserved for domestic Mutual Funds, subject to valid Bids being received from domestic Mutual Funds at or above the price at which Equity Shares will be allocated to Anchor Investors. Port allocation to the Anchor Investors, the QIB Category will be reduced by such number of Equity Shares. Further, 5% of the Net QIB Category (excluding the Anchor Investor Portion) will be made available for allocation on a proportionate basis to Mutual Funds only and the remainder of the Net QIB Category will be made available for allocation on a proportionate basis to all QIBs (other than Anchor Investors), including Mutual Funds, subject to valid Bids being received at or above the Offer Price. Further, not less than 15% of the Net Offer will be made available for allocation on a proportionate basis to Non-Institutional Investors and not less than 35% of the Net Offer will be made available for allocation to Retail Individual Investors, in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received at or above the Offer Price. One-third of the Non-Institutional Portion shall be available for allocation to Non-Institutional Investors with a Bid size of more than ₹ 200,000 and up to ₹ 1,000,000 and two-thirds of the Non-Institutional Portion shall be available for allocation to Non-Institutional Investors with a Bid size of more than ₹ 1,000,000 provided that under-subscription in either of these two sub-categories of the Non-Institutional Portion may be allocated to Non-Institutional Investors in the other sub-category of Non-Institutional Portion in accordance with the SEBI ICDR Regulations, subject to valid bids being received at or above the Offer Price. Further, Equity Shares will be allocated on a proportionate basis to Eligible Employees applying under the Employee Reservation Portion, subject to valid Bids being received from them at or above the Offer Price. All Bidders (other than Anchor Investors) are mandatorily required to participate in the Offer through the Application Supported by Bank Amount ("ASBA") process, and are required to provide details of their respective bank account (including UPI ID in case of UPI Bidders using UPI Mechanism) in which the Bid Amount was blocked by the SCBSs or the Sponsor Bank, as the case may be. Anchor Investors are not permitted to participate in the Anchor Investor Portion through the ASBA process. For further details, see "Offer Procedure" on page 452 of the DRHP.

This public announcement is made in compliance with the provisions of Regulation 26(2) of the SEBI ICDR Regulations to inform the public that our Company is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, an initial public offer of its Equity Shares pursuant to the Offer and has filed the DRHP dated November 5, 2022 with the SEBI on November 5, 2022.

Pursuant to Regulation 26(1) of the SEBI ICDR Regulations, the DRHP filed with SEBI shall be made available to the public for comments, if any, for period of at least 21 days, from the date of filing, by hosting it on the website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e., BSE at www.bseindia.com and NSE at www.nseindia.com and the websites of the BRLMs i.e., ICICI Securities Limited at www.icicisecurities.com; Axis Capital Limited at www.axiscapital.co.in and Kotak Mahindra Capital Company Limited at www.investmentbank.kotak.com. Our Company hereby invites the public to provide comments on the DRHP filed with SEBI with respect to disclosures made therein. The comment is requested to send a copy of the comments sent to SEBI, to the Company Secretary and Compliance Officer of our Company and/or the BRLMs at their respective addresses mentioned below. All comments must be received by our Company and/or the BRLMs and/or the Company Secretary and Compliance Officer of our Company at their respective addresses mentioned herein below in relation to the Offer on or before 5.00 p.m. on the 21st day from the aforesaid date of filing the DRHP with SEBI.

Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in the Offer unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Offer. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Offer, including the risks involved. The Equity Shares have not been recommended or approved by the SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of the DRHP. Specific attention of the investors is invited to "Risk Factors" on page 25 of the DRHP.

Any decision to invest in the Equity Shares described in the DRHP may only be made after the red herring prospectus ("RHP") has been filed with the RoC and must be made solely on the basis of such RHP as there may be material changes in the RHP from the DRHP.

The Equity Shares, when offered, through the RHP, are proposed to be listed on the Stock Exchanges.

For details of the share capital and capital structure of our Company, please see the section titled "Capital Structure" beginning on page 81 of the DRHP. The liability of members of our Company is limited. For details of the main objects of our Company as contained in the Memorandum of Association, please see the section titled "History and Certain Corporate Matters" on page 231 of the DRHP.

BOOK RUNNING LEAD MANAGERS		REGISTRAR TO THE OFFER	
 <div>ICICI Securities Limited ICICI Venture House, Appasahab Marathe Marg, Prabhadevi Mumbai - 400 025 Maharashtra, India Tel: +91 22 6807 7100 E-mail: sbfc ipo@icicisecurities.com Website: www.icicisecurities.com Investor Grievance E-mail: customercare@icicisecurities.com Contact Person: Sameer Purohit/ Sumit Singh SEBI Registration No: INM000011179</div>	 <div>Axis Capital Limited 1st Floor, Axis House, C-2, Wadia International Centre, P. B. Block, Worli, Mumbai - 400 025 Maharashtra, India Tel: +91 22 4325 2183 E-mail: sbfc ipo@axiscap.in Website: www.axiscapital.co.in Investor Grievance E-mail: complaints@axiscap.in Contact Person: Mayuri Arya/Harish Patel SEBI Registration No: INM000012029</div>	 <div>Kotak Mahindra Capital Company Limited 1st Floor, 27 BKC, Plot No. 27, "G" Block Bandra Kurla Complex Bandra (East) Mumbai 400 051 Maharashtra, India Tel: +91 22 4336 0000 E-mail: sbfc ipo@investmentbank.kotak.com Website: www.investmentbank.kotak.com Investor Grievance E-mail: kmccredressal@kotak.com Contact Person: Ganesh Narra SEBI Registration No: INM000008074</div>	 <div>KFin Technologies Limited Senanikun, Tower-B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Hyderabad, Rangareddy 500 032, Telangana, India Tel: +91 40 6716 2222 / 7961 1000 E-mail: sbfc ipo@kfintech.com Investor grievance e-mail: eiwardr@kfintech.com Website: www.kfintech.com Contact person: M. Muralikrishna SEBI Registration No: INR0000000221</div>

All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP.

For SBFC FINANCE LIMITED
On behalf of the Board of Directors
Sd/-
Jay Mistry
Company Secretary and Compliance Officer

Place : Mumbai
Date : November 5, 2022

SBFC FINANCE LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the DRHP dated November 5, 2022 with SEBI. The DRHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e., BSE at www.bseindia.com and NSE at www.nseindia.com, respectively and is available on the websites of the BRLMs, i.e., ICICI Securities Limited at www.icicisecurities.com; Axis Capital Limited at www.axiscapital.co.in and Kotak Mahindra Capital Company Limited at www.investmentbank.kotak.com. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision. Specific attention of the investors is invited to "Risk Factors" beginning on page 25 of the DRHP.

Disclaimer Clause of RBI: The Company has a valid certificate of registration dated October 19, 2022 issued by the Reserve Bank of India under Section 45 IA of the Reserve Bank of India Act, 1934. However, the RBI does not accept any responsibility or guarantee about the present position as to the financial soundness of the Company or for the correctness of any of the statements or representations made or opinion expressed by the Company and for the repayment of deposits/discharge of liabilities by the Company.

The Equity Shares have not been and will not be registered under the United States Securities Act of 1933, as amended (the "U.S. Securities Act") and any other applicable law of the United States and, unless so registered, may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. Accordingly, the Equity Shares are being offered and (a) only to persons reasonably believed to be "qualified institutional buyers" (as defined in Rule 144A under the U.S. Securities Act and referred to as "U.S. QIBs") in transactions exempt from the registration requirements of the U.S. Securities Act, (b) OPs, as defined in Section 2(a)(51) of the U.S. Investment Company Act, and (b) outside the United States in offshore transactions in compliance with Regulation S and the applicable laws of the jurisdiction where those offers and sales are made. There will be no public offering of the Equity Shares in the United States.

CONCEPT



AMI ORGANICS LIMITED
Registered Address: Plot No. 440/4, 5 & 6, Road No. 82/A,
GIDC Sachin, Surat- 394230

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER & HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2022
(Rs. In Lakhs, unless otherwise stated)

Sr. No.	Particulars	STANDALONE			CONSOLIDATED		
		Quarter ended 30/09/2022	Quarter ended 30/09/2022	Quarter ended 30/09/2021	Quarter ended 30/09/2022	Quarter ended 30/09/2022	Quarter ended 30/09/2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1.	Total income	14784.21	27946.68	12247.17	14784.21	27946.68	12247.17
2.	Net Profit before tax	2571.15	4603.24	2252.29	2571.15	4603.24	2252.29
3.	Net Profit after tax	1903.80	3390.01	1747.00	1903.80	3390.01	1747.00
4.	Total Comprehensive income for the period	1889.21	3375.42	1803.64	2004.09	3638.55	1796.14
5.	Paid up Equity Share Capital (Face value of Rs. 10/- each)	3643.71	3643.71	3643.71	3643.71	3643.71	3643.71
6.	Other equity excluding revaluation reserves	-	-	-	-	-	-
7.	Earning per share (of Rs. 10/- each)	5.18	9.26	5.11	5.50	9.99	5.11
	Basic	5.18	9.26	5.11	5.50	9.99	5.11
	Diluted	5.18	9.26	5.11	5.50	9.99	5.11

Notes:

1. The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchanges (www.bseindia.com and www.nseindia.com) and on company's website (www.amiorganics.com).

2. The above Financial Results have been reviewed and recommended by Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 5, 2022.

For and on behalf of Board of Directors of AMI Organics Limited
Sd/-
Nareshkumar R. Patel
Chairman & Managing Director
DIN : 00906232

Place : Surat
Date : November 5, 2022



CNTRUM Home Loans
Also military ghar bhaug

કોર્પોરેટ અને રજીસ્ટર્ડ ઓફીસ : સુપ્રિટ